

**Appendix A to Part 92—Sample Notice Informing Individuals About Nondiscrimination and Accessibility Requirements and Sample Nondiscrimination Statement:  
Discrimination is Against the Law**

CarePoint Health – Bayonne Medical Center સમવાયી નાગરિક અધિકાર કાયદા સાથે સુસંગત છે અને જાતિ, રંગ, રાષ્ટ્રીય મૂળ, ઉંમર, અશક્તતા અથવા લિંગના આધારે બેદભાવ રાખવામાં આવતો નથી. CarePoint Health – Bayonne Medical Center જાતિ, રંગ, રાષ્ટ્રીય મૂળ, ઉંમર, અશક્તતા, અથવા લૈંગિક કારણે લોકો બાકાત નથી અથવા તેમની સાથે અલગ વર્તન કરવામાં આવતું નથી.

CarePoint Health – Bayonne Medical Center:

- અમારી સાથે અસરકારક રીતે સંદેશાવ્યવહાર કરવામાં અક્ષમ જેવા કે અશક્ત લોકો માટે નીચે પ્રમાણેની મફત સહાય અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે:
  - લાયકાત ધરાવતા સાંકેતિક ભાષાના દુભાષિયા
  - અન્ય ફોર્મેટમાં લખાયેલ માહિતી (મોટી પ્રિન્ટ, ઓડિયો, સુલભ ઇલેક્ટ્રોનિક ફોર્મેટ, અન્ય ફોર્મેટ)

• જેની પ્રાથમિક ભાષા અંગ્રેજ ન હોય તેવા લોકોને નીચે પ્રમાણેની મફત ભાષા સેવાઓ પૂરી પાડવામાં આવે છે:

- લાયકાત ધરાવતા દુભાષિયા
- અન્ય ભાષાઓમાં લખવામાં આવેલી માહિતી

તમારે આ સેવાઓની જરૂર હોય તો, સંપર્ક કરો Mohammad Shozub  
જો તમે માનતા હો કે આ સેવાઓ પૂરી પાડવા માટે CarePoint Health – Bayonne  
Medical Center નિષ્ણળ ગયા છે અથવા જાતિ, રંગ, રાષ્ટ્રીય મૂળ, ઉંમર, અશક્તતા અથવા  
લિંગના આધારે અથવા અન્ય પ્રકારે બેદભાવ રાખે છે, તો તમે Mohammad Shozub, Section 1557  
Compliance Coordinator, 201-858-5000, ext. 46323, [Bayonne1557@carepointhealth.org](mailto:Bayonne1557@carepointhealth.org) સમક્ષ  
ફરિયાદ દાખલ કરી શકો છો. તમે ફરિયાદ રૂભરૂમાં અથવા મેઇલ, ફેક્સ, અથવા ઇમેઇલ દ્વારા  
દાખલ કરી શકો છો. તમને ફરિયાદ દાખલ કરવામાં મદદ જોઈતી હોય તો Mohammad Shozub,  
Section 1557 Compliance Coordinator મને મદદ કરવા માટે ઉપલબ્ધ છે.

તમે the U.S. Department of Health and Human Services (ધી યુ. એસ. ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સવીસિસ), Office for Civil Rights (ઓફિસ ફોર સિવિલ રાઇટ્સ) ને પણ) <https://ocrportal.hhs.gov/ocr/portal/lobby.jsf> પર ઉપલબ્ધ Office for Civil Rights Complaint Portal, મારફત વિજાણુ રીતે અથવા નીચેના સરનામે મેઇલ કે ફોન કરી ફરિયાદ નોંધાવી શકો છો

U.S. Department of Health and Human Services  
200 Independence Avenue, SW  
Room 509F, HHH Building  
Washington, D.C. 20201  
1-800-868-1019, 800-537-7697 (TDD)

ફરિયાદનું ફોર્મ અહીં ઉપલબ્ધ છે <http://www.hhs.gov/ocr/office/file/index.html>.